

૧) સાફલ્ય ગાથા (ફોટાઓ સાથે)

૨) સુરક્ષા સેતુ અંતર્ગત થયેલ કાર્યક્રમો તથા તેને અનુરૂપ ફોટાઓ વિગત

સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત ગુજરાત સરકારશ્રીએ સુરત રેન્જને ફાળવેલ સુરક્ષા સેતુ રથ નવસારી જીલ્લાના શાળા/ કોલેજોમાં સુરક્ષા સેતુ હેઠળ અવેરનસ કાર્યક્રમો કરવામાં આવે છે. ગતિશીલ ગુજરાત અંતર્ગત સેલ્ફ ડીફેન્સ તાલીમ , તિરંજાદજી,

ગામ મુલાકાત:

ગતિશીલ ગુજરાત કાર્યક્રમ ૨૦૧૬ અંતર્ગત ટીમ લીડર તરીકે વર્ગ-૧ના અધિકારીઓ સાથે જીલ્લાની નક્કી કરેલ ગામડાઓની મુલાકાત કરી પ્રજાના પ્રશ્નો સાંભળી સ્થળ નિકાલ કરવામાં આવે છે. તેમજ સ્થળ નિકાલ ન થાય તેવા પ્રશ્નો જે - તે વિભાગને કાર્યવાહી કરવા મોકલવામાં આવે છે. વિક દરમિયાન વાંસદા તાલુકાના પ્રશ્નોના નિકાલ કરવામાં આવેલ છે તેમજ બાકી રહેલ પ્રશ્નોને જે જે વિભાગને આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવેલ છે.

લોકસંવાદ સેતુ કાર્યક્રમ સને- ૨૦૧૬-૧૭

વર્ષ૨૦૧૬-૧૭ અંતર્ગત અત્રેના જીલ્લાના અલગ અલગ તાલુકાના ૨૫ જેટલા ગામમાં લોકસંવાદ સેતુ કાર્યક્રમ કરવામાં આવેલ છે. જેમા લોકોના હકારાત્મક,નકારાત્મક તેમજ નીતિ વિષયક પ્રશ્નો વિષયોનો સમાવેશ કરવામાં આવેલ હતા.

ગતિશીલ ગુજરાત અંતર્ગત તાલુકા કક્ષાએ જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવે છે.

કુટુંબ સહાયતા કેન્દ્ર અને ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્ર દ્વારા સાહિત્ય વિતરણ



મુદા નંબર (૧)

૧. જીલ્લા શહેર કક્ષાએ કોઈ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ.
- નવસારી જીલ્લા પોલીસ ધ્વારા વર્ષ ૨૦૦૭ થી આજદિન સુધીના ગુમ થયેલ બાળકો/વ્યક્તિઓ શોધવા અંગે મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.
- ગુમ/અપહરણ થયેલ બાળકોની ભારત સહકાર ધ્વારા શરૂ કરવામાં આવેલ વેબસાઇટ <http://trackthemissingchild.gov.in/missing/index.php> ઉપર રોજ રોજ એન્ટ્રી કરવામાં આવે છે.
- પી.સી.આર. વાન ચીખલી, બીલીમોરા, નવાસરી ટાઉન વિસ્તાર, નવસારી રુરલ, જલાલપોર વિસ્તારમાં તાલીમ બદ્ધ ડ્રાયવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરૂ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્પ મળી રહે.
- ગુમ થયેલ બાળકો અંગે જીલ્લાની મહીલા સુરક્ષા સમિતીની મહીલાઓ તેમજ એન.જી.ઓ. ચાઇલ્ડ વેલ્ફેર ઓફીસર તેમજ જીલ્લાના તમામ અધિકારીઓ સાથે મીટીંગો કરવામાં આવે છે.

મુદા નંબર (૩)

- ટ્રાફિક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.
- ટ્રાફિક સપ્તાહની ઉવજણી કરવામાં આવી રહેલ છે. ટ્રાફિક અવેરનસ અંગે શાળા કોલેજોમાં કાર્યક્રમો કરવામાં આવે છે.
- ટ્રાફિક જનજાગૃતિ અંગે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી ટ્રાફિકના નિયમો સાથેની જાહેર જગ્યાઓ તેમજ શાળા કોલેજોમાં આર.ટી.ઓની મદદથી અવેરનસ કાર્યક્રમો રાખવામાં આવેલ.
- વારંવાર રોડ ઉપર ટ્રાફિક ડ્રાઇવ રાખી ટ્રાફિક અવેરનસ અંગેની સમજ આપવામાં આવે છે.

મુદા નંબર (૪)

- ગુનાઓ અટકાવવા કોઈ વિશિષ્ટ કામગીરી/સ્પેશિયલ અપનાવવામાં આવેલ છે ?
- નેશનલ ૮ તેમજ અન્ય રસ્તાઓ ઉપર એક્સીડન્ટ ઝોન નક્કી કરી રોડ એક્સીડન્ટ, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારુ સી.સી.ટી.વી. કેમેરાની જરૂરીયાત મુજબની યાદી બનાવી કલેક્ટરશ્રી સાથે મિટીંગો કરવામાં આવેલ છે.
- જીલ્લાના નવસારી ટાઉન-૨ નવસારી રુરલ- ૧૬, ચીખલી-૩૭, બીલીમોરા - ૨૩, ઉમરાટ, - ૮, દાંડી-૨ કેમેરા સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવેલ છે.
- નેશનલ હાઇવે નંબર ૮ ઉપર નાઇટ રાઉન્ડ દરમિયાન સેક્ટરવાઇઝ ક્રોસ પેટ્રોલીંગ કરવામાં આવે છે. હોટલો, ઢાબા, તેમજ વાહનોનું ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.
- વારંવાર કોમ્પીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.
- કાઇમ ઇન્સ્વેસ્ટીગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્સ્વેસ્ટીગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે. ક્ષમતા વિકાસનું દરેક પોલીસ સ્ટેશન લેવલે આયોજન કરવામાં આવે છે.

મુદા નંબર (૫)

- અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો.
- સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરૂપે એસ.પી.સી. ના બાળકોને વિવિધ પ્રકારની તાલીમ કેમ્પ, સેમિનારનું આયોજન કરવામાં આવે છે.
- નેશનલ હાઇવે નંબર ૮ તેમજ અન્ય રસ્તાઓ ઉપર એક્સીડન્ટ ઝોન નક્કી કરી રોડ એક્સીડન્ટ, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારુ સી.સી.ટી.વી. કેમેરાની જરૂરીયાત મુજબની યાદી બનાવી કલેક્ટરશ્રી સાથે મિટીંગો ગોઠવવામાં આવેલ છે.
- જીલ્લાના નવસારી ટાઉન વિસ્તારમાં આવેલ ટ્રાફિક નિયમ, કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સીક્યુરીટી સીસ્ટમ અને સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.